



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં એપ્રિલ 17 થી અમલી બનતા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 16, 2020) – COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના સમુદાયને સુરક્ષિત રીતે સર્વિસ આપતી હોવાની ખાતરી કરાવવા, બસ સર્વિસમાં આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી નીચે જણાવ્યા પ્રમાણે ફેરફાર, શુક્રવાર, એપ્રિલ 17 થી અમલમાં આવશે:

બ્રેમ્પટનમાં તબીબી સંભાળ સગવડો અને રોજગારના વિસ્તારો સુધી પહોંચ પૂરી પાડવા સહાયરૂપ થવા, અને અન્ય બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસ સાથે પહોંચ અને જોડાણો સુધારવા નીચેના રૂટ્સમાં સર્વિસ સોમવારથી શુક્રવાર સુધી ચાલુ રહેશે. અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો વડે આ સર્વિસ ટકાવી રાખવા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવશે.

રૂટ 8 સેન્ટર

બ્રેમલી સીટી સેન્ટર, પીલ મેમોરિયલ સેન્ટર અને બ્રેમ્પટન ગેટવે ટર્મિનલ સુધી પહોંચ.

- ફ્રિક્વન્સી 50-મિનિટે
- પહેલી ટ્રિપ બ્રેમલી ટર્મિનલથી સવારે 5 વાગ્યે ઉપડશે
- પહેલી ટ્રિપ બ્રેમ્પટન ગેટવે ટર્મિનલથી સવારે 5:50 વાગ્યે ઉપડશે

રૂટ 9 વોડેન

માઉન્ટ પ્લેઝન્ટ GO, બ્રેમલી ટર્મિનલ અને પૂર્વ છેડામાં રોજગારના વિસ્તારો સુધી પહોંચ.

- ફ્રિક્વન્સી 60-મિનિટે
- પહેલી પૂર્વ તરફ જતી ટ્રિપ માઉન્ટ પ્લેઝન્ટ GO થી સવારે 5 વાગ્યે ઉપડશે
- પહેલી પશ્ચિમ તરફ જતી ટ્રિપ વિલિયમ્સ પાર્કવે અને એડવાક ડ્રાઈવથી સવારે 5:57 વાગ્યે ઉપડશે

રૂટ 52 મેકમર્ક

ડાઉનટાઉન ટર્મિનલ અને બ્રેમ્પટન ગેટવે ટર્મિનલ સુધી પહોંચ.

- ફ્રિક્વન્સી 50-મિનિટે
- પહેલી ઉત્તર તરફ જતી ટ્રિપ બ્રેમ્પટન ગેટવે ટર્મિનલથી સવારે 5 વાગ્યે ઉપડશે
- પહેલી દક્ષિણ તરફ જતી ટ્રિપ ડાઉનટાઉન ટર્મિનલથી સવારે 5:20 વાગ્યે ઉપડશે

હાલમાં સર્વિસ ચાલુ હોય તેવા રૂટ્સ અને તેના સમયપત્રકોની યાદી માટે વેબસાઈટ જુઓ, www.bramptontransit.com.

અમે ઉતારુઓ વચ્ચે શારીરિક અંતર રાખવાના આચરણોને ટેકો આપવા બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠક સુધી સીમિત કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કેટલાક બહુ વ્યસ્ત રૂટ્સ પર વધારાના સંસાધનો ફાળવવામાં આવ્યા છે. લક્ષ્ય એ ખાતરી કરાવવાનું છે કે સંસાધનો છૂટ આપે તેટલી વધારેમાં વધારે સર્વિસ પૂરી પાડવી અને શહેરના તમામ વિસ્તારોને પબ્લિક ટ્રાન્ઝિટની વ્યાજબી પહોંચ પૂરી પાડવી.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજીંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca